

14th November, 2022

To.

Dept. of Corporate Services, BSE Limited, Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Mumbai- 400001

Company Code: 533161

To,

The Listing Department,

National Stock Exchange of India Limited,

Exchange Plaza, Bandra Kurla Complex, Bandra(East), Mumbai 400051

Company Code: EMMBI

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Publication

Please find enclosed copies of newspaper publication, regarding publication of Standalone Un-audited Financial Results of the Company for the quarter and half year ended 30th September, 2022.

We request you to take the same on your record.

Thanking you,

Yours faithfully,

For Emmbi Industries Limited

Company Secretary

Encl.: As Above



FINANCIAL EXPRESS

Karma

Ch L31101M2207FL0188223

Ch L31101M2207FL018823

Repd. Office: 214. Empire House, Dr. D. N. And, Erk. J. K. Tel Nos : 22071501-06 Fax : 22071514 Email : investorate).

Tel Nos : 22071501-06 Fax: 22071514 Entain emboursements of the Financial Results for the Quarter and Half Year ended 30,09.22

[Rs. in Lac except EPS of

| _ | | | Stand | datone | |
|---|---|-----------------------|-----------------------|-----------------------|-----------------------|
| | | Quarter | Ended | Half Yea | r Ended |
| | Particulars - | 30.09.22 Unaudited | 30.09.21 Unaudited | 30.09.22 Unaudited | 30.09.21 Unaudited |
| 1 | Total Income from Operations | 606,91 | 1,135,89 | 1,029,90 | 1,806,37 |
| 2 | Net Profit / (Loss) for the period before Tax | 176,13 | 16,83 | 213,60 | -147.44 |
| 3 | Net Profit / (Loss) for the period after Tax | 217.47 | 43,66 | 303,39 | -93.66 |
| 4 | Total Comprehensive Income for the period | | | | |
| | [Comprising Profits / (Loss) for the period (after Tax) | | | | |
| | and Other Comprehensive Income (after Tax)] | 176.48 | 104.98 | 292.20 | -85.45 |
| 5 | Equity Share Capital | 1,156.99 | 1,156.99 | 1,156,99 | 1,156.99 |
| 6 | Earnings per Share of Rs. 10/- each | | | | |
| | [(for Continuing and Dis-continued Operations | | | | |
| | (not annualised)] | | | | |
| | Basic & Diluted | 1.88 | 0.38 | 2.62 | -0.81 |
| | Mes · | | | | |

EMMBIINDUSTRIES LIMITED

Regd. Off.: 99/2/1 & 9, Madhuban Industrial Estate, Madhuban Dam Road, Rakholi Village,
U. T. of Dadra & Nagar Havelli, Silvassa - 396230 Tel: +91 22 6784 5555, Fax: +91 22 6784 5506;
CIN: L17120DN1994PLC000387 Email: info@ammbl.com, Website: www.emmbl.com

| | Statement of Unaudited Financial Results For th | | | | | | |
|-------|--|---|-------------|-------------|---------------|--------------|-----------|
| | Pursuant to Regulation 33 of SEBI (Listing Obligat | ions and Dis | closure Re | | | | |
| Part- | | | | | ₹ In Millions | | |
| Sr. | DADTIOUS ADO | Quarter Ended 30,09,2022 30.06.2022 30.09.2021 | | | Half Yea | Year Ende | |
| No. | PARTICULARS | | | (Unaudited) | | 30.09.2021 | |
| 1 | Income from Operations | (Ondudited) | (Ondudited) | (Ondudited) | (Ondudited) | (Oriudunicu) | (riddico) |
| ١. | Gross Value of Sales | 1.038.81 | 1.236.73 | 1.321.35 | 2.275.54 | 2.544.63 | 5,103,69 |
| | Less : GST Recovered | 153.58 | 178.49 | | | 375.37 | |
| | (a) Net Sales/ Income from Operations | 885.23 | 1.058.24 | | | 2.169.25 | |
| | (b) Other Income | 0.21 | 0.16 | | | 0.39 | |
| | Total Income from Operations (a+b) | 885.44 | 1,058,39 | | | 2,169,64 | |
| 2 | Expenses | 000.44 | 1,000.00 | 1,127.07 | 1,540.00 | 2,100.04 | 7,007.20 |
| - | (a) Cost of materials consumed | 545.93 | 670,60 | 760.22 | 1,216,53 | 1,480,69 | 2.819.14 |
| | (b) Purchase of Stock-in Trade | 343.33 | 0,0.00 | 700.22 | 1,210.00 | 1,400.00 | 2,010.11 |
| | (c) Changes in inventories of finished goods, and | 1 - | | | | | |
| | work-in-progress and stock in trade | (35.08) | (12,76) | (45,17) | (47,85) | (51,00) | (51.93 |
| | (e) Employee Benefit Expenses | 43.31 | 43.91 | 49.53 | | 91.49 | |
| | (f) Finance Cost | 37.98 | 38.18 | 37.19 | | 70.50 | |
| | (g) Depreciation & Amortisation Expenses | 25.00 | 24,35 | | | 42.41 | |
| | (h) Other Expenses | 233.29 | 250.58 | | | 411.89 | |
| | Total Expenses | 850.43 | 1.014.85 | | | 2.045.98 | |
| 3 | Profit before Exceptional & Extra ordinary items & Tax (1-2) | | 43.54 | 66.53 | | 123.66 | |
| 4 | Exceptional Items | 00.01 | 40.04 | 00.00 | 10.00 | 120100 | 200.00 |
| 5 | Profit before Extra ordinary items and Tax (3-4) | 35.01 | 43,54 | 66,53 | 78.55 | 123,66 | 258.0 |
| 6 | Extra ordinary items | 00.01 | 40.04 | 00.00 | 70.00 | 120.00 | 200.00 |
| 7 | Net Profit from Ordinary Activities before Tax (5-6) | 35.01 | 43.54 | 66.53 | 78.55 | 123,66 | 258.0 |
| 's | Tax Expenses | 33.01 | 40.04 | 00.00 | 70.00 | 123.00 | 200.0 |
| ٠ ا | I. Current Tax | 6.99 | 10.62 | 13,90 | 17.61 | 23.22 | 52.82 |
| | II. Deferred Tax | 3.44 | 2.61 | 3.55 | | 6.63 | |
| 9 | Net Profit for the Period (7-8) | 24.58 | 30.31 | 49.08 | | 93,81 | |
| 10 | Other Comprehensive Income | 24.00 | 00.01 | 40.00 | 04.00 | 55.51 | 100.00 |
| 10 | Remeasurement of Defined Benefit Plans | (0.50) | (0.50) | (0.50) | (1,00) | (1,00) | (0.94 |
| | Income Tax | (0.00) | (0.00) | (0.00) | (1.00) | (1.00) | (0.04 |
| 11 | Total Comprehensive Income for the period (9+10) | 24.08 | 29.81 | 48.58 | 53.90 | 92.81 | 189.39 |
| 12 | Paid up Equity Share Capital (F. V. of ₹ 10/- Each) | 176.90 | 176.90 | 176,90 | | 176.90 | |
| 13 | Other Equity excluding Revaluation Reserve | .,,,,, | .,,,,,,,, | .,,,,,,, | .,,,,,,, | 170.00 | 1,357.09 |
| 14 | Earnings per Share (of ₹ 10/- each) : | 1 | l Î |] | 1 | | 1,557.00 |
| 1-7 | (a) Basic-₹ | 1,39 | 1,71 | 2,77 | 3,10 | 5,30 | 10,76 |
| | (b) Diluted- ₹ | 1.39 | 1.71 | 2.77 | | 5.30 | |
| | (b) Diluieu- 7 | 1.39 | 1./1 | 2.// | 3.10 | 0.30 | 10. |

Notes:

1 The Financial Results have been reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors in their meeting held to 10 November, 2022. The Statutory Auditors of the Company have carried out a "Limited Review" of the financial results for the Quarter and His Year ended 30" September, 2022.

The antire operation of the Company relate to only one segment viz. Polymer based multiple products. Hence, as per the Management's approadured the AS-108, the company has a single operating segment.

| under Ind AS - 108, the company has a sing 3 Figures for the Previous Period / Year have | | | d / re-arranged wherever necessary, to make the | em comparable | |
|---|----------------------------------|--------------------------------|--|----------------------------------|--------------------------------|
| STATEMENT OF ASSETS AND LIA 30™ SEPTEMBER, 20 | BILITIES AS OF 22 | | UNAUDITED STANDALONE CASH F FOR HALF YEAR ENDED 30 ¹¹¹ SEF | LOW STATEM | ENT |
| PARTICULARS | As At 30.09.2022 Unaudited | As At 31.03.2022 Audited | PARTICULARS | As At 30.09.2022 Unaudited | As At 30.09.202 Unaudite |
| A ASSETS | - Cinauantoa | 7 1001100 | (A) CASH FLOW FROM OPERATING | - Ciliaanico | Ondodito |
| 1.Non Current Assets | | | ACTIVITIES : | | |
| Property, Plant & Equipment | 1,399.90 | 1,369.49 | Net Profit Before Tax | 78.55 | 123. |
| Capital Work In Progress | - | - | Depreciation & Amortisation | 49.35 | 42. |
| Intangible Assets | 154.79 | 149.72 | Finance Cost | 76.16 | 70. |
| Financial Assets | | | Sundry Balances Written off | (0.05) | (0.0 |
| Investments | 0.23 | 0.23 | Paid from Provision For Gratuity | (0.80) | (1.5 |
| Loans | 1.03 | 1.03 | Interest Received on Bank FD | (0.36) | (0.3 |
| Other Financial Assets | 14.39 | 18.14 | Dividend Received Rent received | (0.01) | |
| Deferred tax Asset - MAT Credit Entitlement | - | | Interest on Income Tax | 0.78 | |
| Income Tax Asset | 116.34 | 101.88 | (Profit)/ Loss on Sale of Asset | 0.76 | 0. |
| Other Non-Current Assets | 1.69 | 1.84 | (FTOIL) Loss of Sale of Asset | 203,61 | 234. |
| Sub Total - Non Current Assets | 1,688.37 | 1,642.32 | Operating Profit Before Working | | 201 |
| 2. Current Assets | | | Capital Changes | | |
| Inventories | 1,020.20 | 976.95 | Adjustments for Working Capital Changes: | | |
| Financial Assets | | | Trade Payables and Other Current Liabilties | (56.95) | 73. |
| Trade receivables | 648.35 | 759,35 | Inventories | (43.25) | (54.9 |
| Cash & Cash Equivalent | 17.70 | 9.56 | Trade Receivables | 111.06 | (99.5 |
| Bank balances other then above | 9.97 | 0.34 | CASH FLOW FROM OPERATIONS | 214.48 | 153. |
| Other Current Assets | 175.91 | 157.52 | Taxes Paid (Net) | (15.23) | (17,3 |
| Sub Total - Current Assets | 1,872.12 | 1,903.72 | NET CASH FLOW FROM OPERATING | | |
| TOTAL ASSETS | 3,560.49 | 3,546.04 | ACTIVITIES (A) | 199.24 | 136. |
| B EQUITY & LIABILITIES | | | (B) CASH FLOW FROM INVESTING ACTIVITIES | | |
| 1.Equity | | | Purchase of Property, Plant & Equipment | (84,83) | (94.2 |
| Equity Share Capital | 176.90 | 176,90 | Movement in Loans and Advances | (5.74) | (7.4 |
| Other Equity | 1,400.38 | 1,357.09 | Sale Of Fixed Asset | (01, 4, | 0. |
| Sub Total - Share Holders' Fund | 1,577.28 | 1,534.00 | (Purchase) / Redemption of Term Deposits | _ | 5. |
| 2. Non Current Liabilities | | | Interest Received on Bank FD | 0.36 | 0. |
| Financial Liabilities | | | Dividend Received | 0.01 | |
| (a) Borrowings | 475.18 | 500,88 | Rent received | - | |
| Other Non Current Liabilities | - | - | NET CASH (USED IN) INVESTING | | |
| Employee Benefit Provisions | 14.18 | 13.98 | ACTIVITIES (B) | (90.21) | (94.7 |
| Deferred Tax Liabilities | 121.74 | 115.70 | (C) CASH FLOW FROM FINANCING | | |
| Liabilities for Income Tax | 124.03 | 106.42 | ACTIVITIES :- | | |
| Sub Total - Non Current Liabilities | 735,13 | 736.98 | Proceeds / (Repayment) from Long | | |
| 3. Current Liabilities | | | Term Borrowing | (25.70) | (10.5 |
| Financial Liabilities | | | (Increase)/decrease in Working Capital Borrowings | 11.58 | 47. |
| Borrowings | 951.67 | 940.09 | (Loan)/ Repayment to Subsidiary & LLP | 11.56 | (0.0 |
| Trade Payables | 268.96 | 313,23 | Interest paid on Loan | (76.16) | (70.5 |
| Other Financial Liabilities | 27.46 | 21.75 | Dividend Paid | (, 0.10) | (10.0 |
| Provisions | - | - | (Including Dividend Distribution tax) | (10.61) | (7.0 |
| Sub Total - Current Liabilities | 1,248.09 | 1,275.07 | NET CASH FLOW USED IN FINANCING | (, | (|
| TOTAL LIABILITIES | 3,560.49 | 3,546.04 | ACTIVITIES (C) | (100.89) | (40.9 |
| | d on behalf o | | Net Increase / (Decrease) in Cash and | | |
| For E | mmbi Indust | ries Limited | Cash Equivalents (A+B+C) | 8.14 | 0. |
| | | | Cash & Cash Equivalent at the beginning | 9.56 | 9. |
| Place : Silvassa, DNH | | nd Appalwar | Cash & Cash Equivalent at the end | 17.70 | 9. |
| Date: 10th November, 2022 | | 1: 00171950 | 1 This statement is prepared as per Ind AS-7 | | |

KALPATARU ENGINEERING LIMITEI

CIN No: L27104WB1980PLC033133 18, Rabindra Sarani, Poddar Court. Gale No. 4, 4th Flore, Room No. 4, Kokata-700001
UNAUDITED FNANCIAL RESULTS FOR QUARTER AND HALF YEAR ENDED
ON 30TH SEPTEMBER 2022
Rs. Lacs sexcest FPR


| Quarter ending (30/09/2022) | Corresponding 3 months ended the in previous year (30/09/2021) | previous year ended (31/03/2022) |
|-----------------------------------|---|--|
| 32.48 | 6.76 | 229.34 |
| | | |
| 0.950 | 0.500 | 1.520 |
| | | |
| 0.950 | 0.500 | 1.520 |
| 1,821.34 | 1,821.34 | 1,821.34 |
| | | |
| | | |
| _ | _ | _ |
| | | |
| 0.005 | 0.003 | 0.008 |
| 0.005 | 0.003 | 0.008 |
| | ending (30/09/2022) 32.48 0.950 0.950 1,821.34 — 0.005 | ending months ended the in previous year (2009870221) 32.48 6.76 0.950 0.500 0.950 1.821.34 1.821.34 |

the above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the tock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosur equirements) Regulations, 2015.

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST FOR NAMETIC OVERSEAS PRIVATE LIMITED OPERATING IN IMPORT AND EXPORT AT KOLKATA

| | | Bankruptcy Board of India (Insolvency Resolution rsons) Regulations, 2016) |
|-----|---|--|
| | RELEVANTE: | |
| 1. | | M/S DYNAMETIC OVERSEAS PRIVATE LIMITED UD1409/VB1988PTC045536 |
| 2 | Address of the registered office | Registered Office: 85, Ballygunge Garden: Kolkata-700019, West Bengal, India |
| 3. | URLofwebsite | https://dynameticoverseas.co.in/ |
| 4. | are located | Isand and Building thereon at Door 35, TS Ward- Block 14, TS No. 2913, and 2914 part, Ea Ranganathpuram Street, Ward 17, Tuscorin, Tan Naidu, measuring 4.34 Cents. Details regarding location of other fixed assets n available at present (As per the information available other fixed assets are of very neglipible value.) |
| 5. | Installed capacity of main products/services | Not in operation (To the extent information Available |
| 6. | sold in last financial year | Not in operation (To the extent information Available |
| 7. | Number of employees/ workmen. | NIL (To the extent information available) |
| 8. | statements (with schedules) of two years, lists of creditors, relevant dates for subsequent events of the process are available at: | And can also be obtained by sending email vogeshgupta31@rediffmail.com |
| 9. | Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at: | Eligibity for the resolution applicants can be obtaine at: https://insolvencyandbankruptcy.in/wj content/uploads/2022/09/EOI- and- Can be obtained by sending email to yogeshgupta31@rediffmail.com |
| 10 | Last date for receipt of expression of interest | 22.11.2022 |
| 11. | Date of issue of provisional list of prospective | 01.12.2022 |

















EXTRACT OF THE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE 2ND QUARTER AND

| Sr. No. | Particulars | 30th September, 3 Months ended 3 Months ended 2022 30th June, 2022 2022 2022 2022 2022 2022 2022 20 | | September, | Corresponding Half Year ended on 30th September, 2021 | Year ended 31st March, 2022 | |
|------------|---|--|-----------|------------|---|-----------------------------------|-----------|
| | | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited |
| 1 | Total income from operations | 16,850.84 | 16,122.10 | 11,170.38 | 32,972.94 | 20,934.87 | 48,781.68 |
| 2 | Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) | 801.33 | 761.45 | (3.14) | 1,562.78 | (310.41) | 426.84 |
| 3 | Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items) | 804.52 | 755.47 | (10.59) | 1,559.99 | (317.07) | 397.94 |
| 4 | Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items) | 587.60 | 547.34 | (10.59) | 1,134.94 | (317.07) | 224.28 |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and other comprehensive income (after Tax)) | 587.60 | 547.34 | (10.59) | 1,134.94 | (317.07) | 262.71 |
| 6 | Paid up Equity Share Capital (face value of ₹10/- each) | 1,704.00 | 1,704.00 | 1,704.00 | 1,704.00 | 1,704.00 | 1,704.00 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | - | - | - | - | - | 17,196.33 |
| 8 | Earnings Per Equity Share (of ₹10/- Each) (Not Annualised) (for Continuing and Discontinued operations) (Basic & Diluted) | | | | | | |
| | Basic : | 3.45 | 3.21 | (0.06) | 6.66 | (1.86) | 1.54 |
| | Diluted : | 3.45 | 3.21 | (0.06) | 6.66 | (1.86) | 1.54 |

Note: (a) The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the 2nd Quarter and Half Year ended 30th September, 2022, as filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (stating Obligation and Disclosurs Repuirements) Regulations, 2015. The full format of the above Quarterly and Half yearly Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on the website of the Company (www.libertyshoes.com)

| ೧ ೯೪) | |
|------------------|-----|
| FORTUNE | COO |
| FURTURE | 000 |









LIBERTY

SUNII BANSAI DIN: 00142121

Registered Office: Libertypuram, 13th Milestone, G.T. Karnal Road, Kutali, P.O. Bastara, Dist. Karnal - 132114, Haryar Corporate Office: Ground Floor, Building No. 8, Tower A, DLF Cyber City, Phase - II, Grungriam - 122002, Haryana E-mail 10: Intersofrance@ilbertyhoses.com, Website; www.libertyhoses.com CIN: L19201HR1986PLC 033185

APM TERMINALS ગુજરાત પીપાવાવ પોર્ટ લીમીટેડ

APM TERMINALS
Litring Global Trade
CIN: L63010GJ1992PLC018106
રજીસ્ટર્ડ ઓફીસ : પીપાલાવ પોર્ટ લીમીટેડ, મુકામ—પોસ્ટ રામપાર—ર વાચા રાજુલા જિલ્લો—અમરેલી ગુજરાત–3દૃપ પદ્દo
ફોના : ૦૨૭૯૪ ૨૪૨૪૪૦ ફેન્ક્સ : ૦૨૭૯૪ ૨૪૨૪૪૦ વેન્સા ૨૦૩૯૧ વેન્સ ૧૦૩૯૧ વેન્સા વ્યક્ત

<u>શેરદ્યારકોને નોટીસ</u>

કંપની ધારા ,૨૦૧૩ ('કાચદો') ની કલમ ૧૧૦ અને કંપની (વ્યવસ્થાપન અને વહિવટ) નિયમો, ૨૦૧૪ ('નિયમો') નાં નિયમ ૨૨ સાથે વાંચીને અહીં નોટીસ આપવામાં આવે છે કે, ગુજરાત પીપાવાવ પોર્ટ લીમીટેડ ('કંપની') એ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ નાં રોજ કેન્કિના ટેકનોલોછુત્ત પ્રાથવેય લીમીટેડ (રછુસ્ટ્રાર અને શેર ટ્રાન્શફર એજન્ટો/કેન્કિનટેક) દ્વારા ડિપોઝિટરીઝ કે કંપનીમાં રછુસ્ટર્ડ ઇમેશન આઇડી ધરાવતા સભ્યોનો લોગીન આઇડી અને પાસવર્ડ સાથે ઇમેશન મોકલવાની પ્રક્રિયા પુર્ણ કરી છે, જેમાં નીચેના કરાવ માટે શેરધારકોની મંજૂરી માંગવામાં આવી છે :

- મેસર્સ માર્તગી ગૌરીશંકર (DIN: 01518137) ની 3 ઓગસ્ટ, ૨૦૨૨ થી ૨ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી સતત પાંચ વર્ષનાં
- ગાળા માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણુંક કરવી. મઅરર્ક A/S સાથે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનની મંજુરી

મઅર્સ્ક A/S સાથે સ્લિટેડ પાર્ટી ટ્રાન્ગેડલનની મંજુરી કંપની ધારા, ૨૦૧૩ (સંગ્રદી) નિચમો, ૨૦૧૪ ના લિગમ કંપની ધારા, ૨૦૧૩ (સંગ્રદી) નિચમો, ૨૦૧૪ ના લિગમ વડ અને કંપની પ્રત્યાન અને વહિવારી) નિચમો, ૨૦૧૪ ના લિગમ વડ ના સંબંધમાં, તેમાં કોપોરેટ મંગાલયે પ મે, ૨૦૨૨ ના રોજ ઇસ્યુ કરેલા સાધારણ પરિપત્ર નંબર ૦૩/૨૦૨૨ તથા ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ ઇસ્ત્રદી છે. એક ઇન્ડિયા (સેબી) ના પરિપત્ર નંબર ૧૯ કદાકા/HO/CFD/CMD2/CIR/P/2021/11 મુજબ, ગા હરાવ ગુજરાત પીપાવાલ પોર્ટ લીમોરેડ ('હંપની') ના સભ્યો દ્વારા સ્મિટે ઇ-વોટીંગ દ્વારા પસાર કરવામાં આવશે એની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કોપોરેટ મંત્રાલય અને સેબીના ઉપર ઉત્તેષ્ટન પાર્ટી અને સ્માર કરવામાં આવશે એની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કોપોરેટ મંત્રાલય અને સેબીના ઉપર ઉત્તેષ્ટન પરિપત્રો અનુસાર, ૩ કિસેમ્બર, ૨૦૨૨ સુધી સભ્યોએ સાધારણ અને વિશેષ હરાવો પાસાર કરવામાં કે કેચ્યુમેન્ટની લઈ કોપી ઘરનું કરવાની ૧૦૨ કરેલી નથી. કોપોરેટ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલા કથિત પરિપત્રોનાં સંબંધમાં કંપની ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ પોસ્ટલ બેલોટ નીહાર કોપો આ પોસ્ટાઇ ને કોપોરેટ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલા કથિત પરિપત્રોનાં સંબંધમાં કંપની ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ પોસ્ટલ બેલોટ નીહાર કોપી આ પોસ્ટાઇ તેલીટ માન્યો કેપન ક્યોને માન્ય કોપોર પાસ્ટિયાન મોર્ટ કેપોર માન્યો સ્ત્રી કોપી આ પોસ્ટાઇ તેલેટ માન્યો કોપોર કોપોર પાસ્ટિયાન મોર્ટ કોપોર પાસ્ટિયાન મોર્ટ કોપોર પાસ્ટિયાન માર્ચ કોપોર પાસ્ટિયાન માર્ચ કોપોર પાસ્ટિયાન માર્ચ કોપોર પાસ્ટ કેપિક સ્ત્રી સ્ત્રી માર્ચ કેપાર કર્યા હોયો માર્ચ કરી છે. કંપનીએ સભ્યો દ્વારા ઇમેઇલ આક્યાર્ડીનો મોર્ટ વ્યવસ્થા કરી છે. કંપનીએ સભ્યો દ્વારા ઇમેઇલ આક્યર્ડીના સંત્રાલ કર્યા કરી છે. સ્ત્રીના અસ્ત્ર સ્ત્રાઇના ક્રાયાર કરવા કર્યા સ્ત્રાદ્વાર સ્ત્રી કર્યા કર્યા કરવા માર્ગ કર્યાલ કરા માર્ગ કર્યા કરા કરવા સ્ત્રા કર્યા કરા ઇમેડ સ્ત્રાન કર્યા હોયા માર્ચ કરવા માર્ગ કર્યાલ કરા કરા કરા કર્યા કરવા સ્ત્રી કર્યા સ્ત્રા કરવા સ્ત્રા કરવા સ્ત્રા કરવા કરવા સ્ત્રા કરવા માર્ગ કર્યાલ સ્ત્રા કરવા સ્ત્રા કરવા સ્ત્રી કરવા સ્ત્રા કરવા સ્ત્રા કરવા સ્ત્રી સ્ત્રા કરવા સ્ત્રા કર્યા કર્યા કરવા સ્ત્રી સ્ત્રા કરવા સ્ત્રા કરવા સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્રાય કરવા સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી

એ સભ્યો તેમના ઇમેઇલ આઇડી પ્રદાન કરવા https://ris.kfintech.com/dientservices/postalballot/ ની મુલાકાત લઇ શકે છે અને તેમને ઇ–વોટીંગમાં સહભાગી થવા લિંક સાથે ઇમેઇલ મળશે.

ઇમેઇલના સફળ રજીસ્ટ્રેશન પછી સભ્યને નોટીસની સોફ્ટ કોપી મળશે અને યુઝર આઇડી અને પાસવર્ડ સાથે ઇ– વોટીંગ માટેની પ્રક્રિયા આ પોસ્ટલ બેલોટ માટે રિમોટ ઇ–વોટીંગ માટે તેમને સક્ષમ બનશે. જો સભ્યને કોઇ પૂછ્યસ્છ કરવી હોય, તો તેઓ evoting@kfinten.com પર મેઇલ કરી શકે છે. પોસ્ટલ બેલોટની કથિત નોટીસ કંપનીની વેબસાઇટ www.pipavav.com પર પણ મુકવામાં આવી છે.

કંપનીના બોર્ડ ઓફ્ડ ડાયરેક્ટર્સને તટસ્થ અને પારદર્શક રીતે ઈ–વોટીંગ પ્રક્રિયા હાથ ધરવા શ્રી હિંમાશું એસ. કામદાર્ કંપનોના બોર્ડ ઓફ કાયરેક્ટરોન તરસ્થ અને પારદર્શક રીતે ઇ–વોટીંગ પ્રક્રિયા હાથ ઘરવા થો હિમાશું એસ. કામદાર (મેમ્બરલિપ બોજ પણ અને એમની ગેરફિલ્યુંએ એમ. શાહ, (મેમ્બરલિપ બોજ પણ 30) પાર્ટનાંમું, મેસર્વે રાત્રે એક એમ હોય એમને એમ્લર્ગ કેરફિલ્યુંએ એમ. શાહ, (મેમ્બરલિપ બોજ પણ 30) પાર્ટી રહ્યાં પડિયા થયેલા મેતદાનાં પાર્ટિશામોને પાર્ચી સ્કુદિનાઇ ગુરું ને હોય પાર્ચી સ્કુદિનાઇ ગુરું ને હોય મેતદાનાં પાર્ટિશામોને કાંચદાની કલમ ૧૧૦ ની જેમેગલાઇઓને કંપનીઝ (વ્લવસ્થાપન અને વહિલટ) બિયમો, ૨૦૧૪ ના નિચમ ૨૨ સાથે વાંચીની ૧ નવેમ્બર, ૨૦૨૨ ના સેજ જાહેર કરવામાં આવશે. પોસ્ટલ બેલોટના પરિણામો કંપનીની વેબસાઇટ અપ્ત્રાણ અંગ હોય ત્યાં ત્યાં ત્યાં ત્યાં ત્યાં ત્યાં સ્કુદન બેલોટના પરિણામો કંપનીની વેબસાઇટ અપ્ત્રાણ અને અધ્યાસ કર્યા હોંચીને ૧ નવેમ્બર, ૮૦૦૫ પર મુકવામાં આવશે તથા ને શેવાન સ્ટોક એક્સરલેજ (એનએસઇ) અને બીએસઇ લીમીટેક (બીએસઇ) ને સબ્લિપ્ટ કરવામાં આવશે, જ્યાં કંપનીનાં ઇક્લિટી શેર લિસ્ટેક છે.

(સાંભારક) જો દાગાન કરવાના આવતા, જ્યાં કરવાના છોકવા તર લાલટક છે. સંબી (લિસ્ટિંકોની જ્વાબદારી અને કિસ્કલોઝરની જરૂરિયાતો), નિયમન, ૨૦૧૫ ના નિયમન જ જે હેઠળ અને નિયમોના નિયમ ૨૨ મુજબ, કંપનીએ એના સભ્યોને સ્મિટ ઈ–મતદાનની સુવિધા પુરી પાડવા કેફિન ટેકનોલોજીસ પ્રાઇવેટ લીમીટેડ સાથે જોડાઇ કર્યું છે.

રાભ્યોનાં નામે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (કટ–ઓફ ડેટ) નાં રોજ રજીસ્ટર્ડ શેરનાં પેઇડ–અપ મુલ્યને આધારે સભ્યોન મતાધિકારનું મુલ્ય ગણવામાં આવશે તથા નોઢીસ સભ્યોને (પોતાના રજીસ્ટર્ડ ઇમેઇલ આઇડી ધરાવતા સભ્યોને) ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી છે, જેમનાં નામો એ તારીએ સભ્યોને રજીસ્ટર્ટ/બેનિફિસિચલ ઓનરાંમાં સામેલ છે. સભ્યોને આ ભાબત નોંધવા લિનંતી કરવામાં આવે છે કે, તેઓ ર ઓક્ટોબર, ૨૦૨૨ ના સવારે ૯.૦૦ વાગ્યાથી 3૧ ઓક્ટોબર, ૨૦૨૨ ના સાંજનાં ૫.૦૦ વાગ્યા સુધી તેમનો મત આપી શકે છે. કૃપા કરીને નોંધ લેશો કે, ત્યારબાદ ઇ– મતદાન મોડ્યુલ મતદાનની સુવિધા બંધ થઇ જશે.

ા ત્યું કે મતદાન સાથે સંબંધિત ફરિચાદોનું બિતારણ કરવા માટે જ્લાબદાર વ્યક્તિનો સંપર્ક કરતો, જેની વિગત છા મુજબ છે : સુશ્રી સૌ શોભા આનંદ, ડેપ્યુરી જનરલ મેનેજર, ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૩૦૯ ૪૦૦૧, કેન્દ્રિન ટેકનોલોશુર તાલંગેટ લીમીટેડ (ચુનિટ : ગુજરાત પીપાવાલ પોર્ટ લીમીટેડ) સેલેબિયમ બિલ્ડીંગ બી, પ્લોટ ૩૧ અને ૩૨, ગાસીબાવલી ફ્લ્યનાબ્સિયલ કિસ્ટ્રીક્ટ, નાનાકરામગુરા, હૈદ્રાબાદ-૫૦૦૦૩૨, તેલંગણા, ભારત.

બોર્ડ માટે અને બોર્ડ તરફથી

સ્થળ : મુંબઇ તારીખ : ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨

કંપની સેક્રેટરી એસીએસ નં. ૧૨૦૪૫



HEC INFRA PROJECTS LIMITED

Registered Office: Sigma-1 Corporates, Corporate House No. 6, Sindhu Bhavan Road, Nr. Maan Party Plot Bodakdev, Ahmedahad-380054, Gujarat Phone: +917-940086771-4 E: elect(@heogropict.com, W. www.beogrojects.in, GNI: L4520062099FLC048870 Itandalone Un-audited Financial Results for the Quarter Ended and half year ended on 30" September 2022

| ı | | | | | | | (< in lakhs) |
|------------|--|---------------------------|---------------------------|---------------------------|---------------------------|---------------------------|-------------------------|
| | | For | the Quarter o | ended | Half Yea | r ended | F.Y. ended |
| Sr. No. | Particular | 30-09-2022 (Unaudited) | 30-06-2022 (Unaudited) | 30-09-2021 (Unaudited) | 30-09-2022 (Unaudited) | 30-09-2021 (Unaudited) | 31-03-2022 (Audited) |
| 1. | Total income from Operations | 891.68 | 1201.38 | 1053.57 | 2093.06 | 1771.20 | 4447.53 |
| 2. | Net Profit/(Loss) for the period | 22.57 | 15.95 | 17.36 | 38.52 | 27.74 | 55.78 |
| | (before Tax, Exceptional and/or Extraordinary items) | | | | | | |
| 3. | Net Profit/(Loss) for the period before Tax | 22.57 | 15.95 | 17.36 | 38.52 | 27.74 | 55.78 |
| | (after Exceptional and/or Extraordinary items) | | | | | | |
| 4. | Net Profit / (Loss) for the period after tax | 22.57 | 12.10 | 12.45 | 28.52 | 20.24 | 51.45 |
| | (after Exceptional and/or Extraordinary items) | | | | | | |
| 5. | Total Comprehensive Income for the period | 22.57 | 12.10 | 12.45 | 28.52 | 20.24 | 51.45 |
| | [Comprising Profit / (Loss) for the period (after tax) and | | | | | | |
| | Other Comprehensive Income (after tax)] | | | | | | |
| 6. | Equity Share Capital (F.V. Re. 1/- per share) | 1013.82 | 1013.82 | 1013.82 | 1013.82 | 1013.82 | 1013.82 |
| 7. | Reserves (excluding Revaluation Reserve) as shown in | - | - | - | - | - | - |
| ı | the Audited Balance Sheet of the previous year | l | l | | | l | |
| 8. | Earnings Per Share (of Rs.1/- each) (for continuing and | 0.22 | 0.12 | 0.12 | 0.28 | 0.20 | 0.51 |
| ı | discontinued operations) Basic & Diluted | l | l | | | l | |

Place : Ahmedabad Date : November 10, 2022

- The above Un-audited financial Results (Standalone) have been reviewed by the audit committee and approved by the Board of Directors of the company at their respective meeting, had on Nevember 10,2022. The above unaudited financial results have been prepared in accordance with the Companies formation accounting strandards/Rides.2015(IND AS) as smanded,prescribed under Section 133 of the Companies Act,2013,rade with relevant rules issued thereunds. The company personnel is supported by the section 133 of the Companies Act,2013,rade with relevant rules issued thereunds. The company personnel is supported by the section 133 of the Companies Act,2013,rade with relevant rules issued thereunds of the section 133 of SEBIListing Obligations and Disclosure Requirements/Regulations, 2015, the Auditor has conducted a Limited review of the above financial results for the quarter and half year ended on 30" September, 2022.

 Previous periods/ver's figures have been regrouped/rearranded wherever necessary, to confirm to the current half-year's year's classification. The full format of the said Financial Results is available on Stock Exchange website www.nesindia.com and on Company's website www.heccroicets.in.

For and on behalf of the Board of Directors of HEC Infra Projects Limited

عربر Gaurang Shah - (Managing Director) DIN: 017<u>56079</u>



એમ્બી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

રજી.ઓફીસ: લ્ફ્રાંગ અને ૬, મધુબન ઇન્ડરટ્રીયલ એસ્ટેટ, મધુબન દામ રોડ, રાખોળી ગામ, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ, સિલ્લાસા–૩૯૬૩૦. હેલિ: નલ ૨૨ દૃઢલ્ડ પાપાપા, ફેક્સ: નલ ૨૨ દૃઢલ્ડ પાપાપા CIN: L17120DN1994PLC000387 છમેકલ: info@emmbi.com વેબસાઇટ: www.emmbi.com

સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાચરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ અન્વયે ૩૦ સપ્ટેમ્બર,

| માગ- | 9 | | | | | રૂ . મિલિચનમાં | |
|------|---|------------|----------------|----------------|------------|---|--------------|
| 송시 | | | માસિક ગાળાના ર | | છ માસ | | વર્ષનાં અંતે |
| oi. | વિગત | 30.09.2022 | 30.06.2022 | 30.09.2021 | 30.09.2022 | 30.09.2021 | 31.03.202 |
| | | અનઓકીટેક | અનઓકીટેક | અનઓડીટેડ | અનઓડીટેડ | અનઓકીટેક | ઓકીટેક |
| 1 | કામકાજમાંથી આવક | 000000000 | 97509-107093 | CTOSCING GOODS | | 000000000000000000000000000000000000000 | 530035055 |
| | વેસાલની કુલ કિંમત | 1,038.81 | 1,236.73 | 1,321.35 | 2,275.54 | 2,544.63 | 5,103.6 |
| | બાદ- જુએસટી રીકવરર્ડ | 153.58 | 178.49 | 193.69 | 332.07 | 375.37 | 747.4 |
| | (એ) કામકાજમાંથી સોપ્ખા વેસાણ /આવક | 885.23 | 1,058.24 | 1,127.66 | 1,943.47 | 2,169.25 | 4,356. |
| | (બી) અન્ય આવક | 0.21 | 0.16 | 0.28 | 0.36 | 0.39 | 1. |
| | કામકાજમાંથી કુલ આવક (એ+બી) | 885.44 | 1,058.39 | 1,127.94 | 1,943.83 | 2,169.64 | 4,357. |
| 2 | ખર્શ | ××0.00000 | | | | | |
| | (એ) વપરાશેલ મટીરીયલનો ખર્ચ | 545.93 | 670.60 | 760.22 | 1,216.53 | 1,480.69 | 2,819. |
| | (બી) સ્ટોક ન્ઇન ટ્રેકની ખરીદી | _ | - | | - | - | |
| | (भी) तैयार भाव राजे वर्त-गन प्रोजेश राजे | | | | | | |
| | સ્ટોક ઇન ટ્રેડ ની આવકસુથીઓમાં કેરકાર | (35.08) | (12.76) | (45.17) | (47.85) | (51.00) | (51.9 |
| | (ઇ) કર્મસારીઓના લાભાર્શે ખર્સ | 43.31 | 43.91 | 49.53 | 87.22 | 91.49 | 197. |
| | (એક) દિરાશ મર્ચ | 37.98 | 38.18 | 37.19 | 76.16 | 70.50 | 146. |
| | (જા) ધરાણે અને ગ્રહ્મસમાપન ખર્ચ | 25.00 | 24.35 | 21.63 | 49.35 | 42.41 | 87. |
| | (એવ) અન્ય ખર્ચ | 233.29 | 250.58 | 238.01 | 483.87 | 411.89 | 900. |
| | લબ મર્ચા | 850.43 | 1.014.85 | 1.061.41 | 1.865.28 | 2.045.98 | 4.099. |
| | વેરા,અપવાદરૂપ સીજો અને અસાધાણ સીજો પૂર્વે નકો (૧–૨) | 35.01 | 43.54 | 66.53 | 78.55 | 123.66 | 258. |
| | અપવાદરૂપ ચીજો | | 10.01 | 00.00 | 10.00 | 120.00 | 200 |
| | વેરા અને અસાધારણ સીજો પહેલા નફો (3–૪) | 35.01 | 43.54 | 66.53 | 78.55 | 123.66 | 258. |
| | અસાધારમ સીજો | 33.01 | 40.04 | 00.00 | 70.00 | 120.00 | 200. |
| | વેરા પૂર્વે સામાન્ય કામકાજમાંથી સોખ્બો નફો (૫–૬) | 35.01 | 43.54 | 66.53 | 78.55 | 123.66 | 258. |
| | વેરા પૂર્વ સામાન્ય કામકાજમાંથા સાખ્યા નફા (વ=દ્ર) | 33.01 | 45.54 | 00.00 | 70.55 | 123.00 | 2.00. |
| | ૧. સાલ લેશ | 6.99 | 10.62 | 13.90 | 17.61 | 23.22 | 52. |
| | a Diciola da | 3.44 | 2.61 | 3.55 | 6.04 | 6.63 | 14. |
| 0 | ગાળા નો સોળ્યો નકો (૭-૮) | 24.58 | 30.31 | 49.08 | 54.90 | 93.81 | 190. |
| 0 | અન્ય સંયુક્ત આવક | | | | | | |
| ~ | ડિકાઇન્ડ બેનીકીટ પ્લાન્સનું પૂર્વમાપન | (0.50) | (0.50) | (0.50) | (1.00) | (1.00) | (0.9 |
| | ones de | (0.50) | (0.00) | (0.00) | (1.00) | (1.00) | (0.2 |
| 1 | आवानी दुव संयुक्त आवक (०+९०) | 24.08 | 29.81 | 48.58 | 53.90 | 92.81 | 189. |
| 2 | ભરપાઇ થયેલ ઇક્લિટી શેર મુકી (પ્રતિદિક રૂા. ૧૦/—ની મુઇ કિંમત) | 176.90 | 176.90 | 176.90 | 176.90 | 176.90 | 176 |
| 3 | પૂર્વમુલ્સાંકિત અનામતો સિવાસની અન્ય ઇક્વિટી | 170.90 | 170.90 | 170.90 | 170.90 | 176.80 | 1,357. |
| 4 | યુંગમુલ્સાક્ત અગામતા ભવાસના અન્ય શક્તરા સેર દીઠ કમાણી (પ્રતિદિઠ રૂા. ૧૦/–ની) | | 1 | | · 1 | | 1,007 |
| | (2) HO - 31. | 1,39 | 1.71 | 2.77 | 3.10 | 5.30 | 10. |
| | (ઓ) મુળ- ફા. (બી) ઘટાડેલી - કા. | 1.39 | 1.71 | 2.77 | 3,10 | 5.30 | 10. |
| | | 1.39 | 1.71 | 2.11 | 3.10 | 5.30 | 10 |

- ----નાણાંકિય પરિણામોની ઓડિટ કમીટી દ્વારા સમીક્ષા અને ભલામણ કરાઈ હતી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ૧૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ તે કર્યા હતા. કંપીના રહેચ્યુટરી ઓડિટરોએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને છ માસિક ગાળાના નાશાંકિય પરિણામોનું લીમીટેડ રીવ્યુ કર્યો હતો. કંપનીના સંપૂર્ણ કામકાજો એક ક્ષેત્રને સંબંધિત છે એટલે કે પોલીમર બેઝડ મલ્ટીપલ પ્રોડક્ટ્સ પરિણામે, ઇન્ડ એએસ—૧૦૮ હેઠળ મેનેમેન્ટના નિર્વદન મુજબ કંપની એકમાત્ર ઓપરેટીંગ સેગમન્ટ ધરાવે છે.

| ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ અને લાયબીલીટ | | | ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજપુરા થતાં છ માસિક ગાળાના અનઓડિટેડ અલાયદા સેક્ડ પ્રવાહ નિવેદન ભાગ-૩ રૂા. મિલિયનમાં | | | | |
|---|---|---|--|---------------------------------|---------------------------------|--|--|
| PHDI-9 | | ા. મિલિયળમાં | | | | | |
| વિગત | 30.06.૨૦૨૨ નાં સેજ અનઓડીટેડ | 39.03.૨૦૨૨ નાં શેજ ઓડીટેડ | વિગત | 30.0€.૨૦૨૨ મુજબ અનસોડીટેડ | ૩૦.૦૯.૨૦૨૧ મુજબ અનસોકીટેક | | |
| એ. અસક્યામતો | | | એ. કામકાજી પ્રવૃતિઓમાંથી સેકડ પ્રવાહ | | | | |
| ૧. બિન–વર્તમાન અસકયામતો | | | | | | | |
| મિલકત, પ્લાન્ટ અને ઉપકરણો | 1.399.90 | 1.369.49 | વેસ પર્વે ચોખ્બો નકો | 78.55 | 123.66 | | |
| કેપીટલ વર્ક છન પ્રોગ્રેસ | ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, | | દાસારો અને ઋતાસમાયન | 49.35 | 42.41 | | |
| અમૃર્ત અસકસામતો | 154.79 | 149.72 | દિક્ષણ ખર્સ | 76.16 | 70.50 | | |
| નાણાંકિય અસકયામતો વાણાંકિય અસકયામતો | 104110 | 140.72 | સન્ડાય બેલેન્સીસ રીટન ઓક | (0.05) | (0.06) | | |
| રોકાઓ | 0.23 | 0.23 | ગ્રેઝ્યુઇટી માટેની જોગવાઇઓમાંથી યુકલેલ | (0.80) | (1.54) | | |
| લોઓ | 1.03 | 1.03 | બેંક એકડી પર પ્રાપ્ત વ્યાજ | (0.36) | (0.30) | | |
| લાના અન્ય નાણાંકિય અસક્યામતા | 14.39 | 18.14 | મળેલ ડિવિડન્ડ | (0.01) | (/ | | |
| ભાગ માણાકાર અસકાવામાં વિલોબિલ વેસ એસ્ટ્રેટ-એમએટી કેડીટ | 14.39 | 10.14 | મળેલ ભાડું | | - | | |
| ાવલાખત વરા અસટ- અમસટા કડાટ ઓન્ટાલટલમેન્ટ | 116.34 | 101.88 | આવકલેશ પર બાજ | 0.78 | | | |
| અનટાઇટલમન્ટ આવક વેસ અસક્યામતો | 1.69 | 1.84 | મિલકતોના વેચારા પર (નફો)/નુકશાન | | 0.07 | | |
| | | | | 203.61 | 234.75 | | |
| પેટા કુલ=બિન વર્તમાન અસક્ચામતો | 1,688.37 | 1,642.32 | કામકાજી મુકીમાં ફેરફાર પહેલા કામકાજી નફો | 604000000 | | | |
| 2. વર્તમાન અસક્યામતો | | | - | | | | |
| આવકસુથીઓ | 1,020.20 | 976.95 | કામકાજી મૂડીમાં ફેરફારો માટે ગોઠવણા | | | | |
| નાણાંકિય અસકથામતો | | | વેપારી યુકવવાપાત્ર અને અન્ય વર્તમાન જવાબદારીઓ | (56.95) | 73.49 | | |
| લેપારી મળવાપાત્ર | 648.35 | 759.35 | આવકસુત્રીઓ | (43.25) | (54.99) | | |
| રોકડ અને રોકડ સમતુત્ય | 17.70 | 9.56 | વેપારી મળવાપાત્ર | 111.06 | (99.51) | | |
| ઉપરોક્ત સિવાચના બેંક બેલેન્સીસ | 9.97 | 0.34 | કામકાજમાંથી શેકક પ્રવાહ | 214.48 | 153.74 | | |
| અન્ય વર્તમાન અસક્યાતા | 175.91 | 157.52 | યુકવાયેલ લેશ(યોખ્ના) | (15.23) | (17.33) | | |
| પેટા કુલ— વર્તમાન અસક્યામતો | 1,872.12 | 1,903.72 | કામકાજી પ્રવૃતિઓમાંથી | - | | | |
| કુલ અસક્યામતા | 3,560.49 | 3,546.04 | ચોખનો શેક્ડ પ્રવાહ (એ) | 199.24 | 136.41 | | |
| બી. ઇક્લિટી અને જવાબદારીઓ | | | (બી) શેકાણ પ્રવૃતિઓમાંલી | | | | |
| 1. v(6az) | | | રોકડ પ્રવાહ | 94,035 | | | |
| ઇક્વીટી શેર મુડી | 176.90 | 176.90 | મિલકત, પ્લાન્ટ અને ઉપકરણોની ખરીદી | (84.83) | (94.20) | | |
| અન્ય ઇક્લિટી | 1,400,38 | 1,357.09 | લોન અને આગોતરામાં ફેરબદલ | (5.74) | (7.47) | | |
| પેટા કલ-લેસ્ફોલ્કરોનું ઇક | 1,577.28 | 1,534.00 | ફીક્સ્ડ અસક્યામતોનું વેચાણ | - | 0.90 | | |
| 2. બિન વર્તમાન જવાબદારીઓ | 1,011120 | 1,001100 | ટર્મ ડિયોઝીટોની (ખરીદી)/વળતર | | 5.76 | | |
| નાણાંકિસ જવાબદારીઓ | | | બેંક એફડી પર મળવાપાત્ર ત્યાજ | 0.36 | 0.30 | | |
| (એ) ઉદ્યારો | 475.18 | 500.88 | મળવાપાત્ર ડિવિડન્ડ | 0.01 | | | |
| (અ) ઉવારા અન્ય બિન વર્તમાન જવાબદારીઓ | 470.10 | 300.00 | મળવાપાત્ર ભાડુ | - | | | |
| અન્ય ાળન ઘલમાન જઘાળદારામાં કર્મચારીઓના લાભાર્થે જોગવાદાઓ | 14.18 | 13.98 | શોખની શેકક (વપરાજ્ઞમાં) | | 10 1 70 1 | | |
| કમસારાઆના લાભાચ જાગવાદઆ વિલંબીત હેરા જ્યાબદારીઓ | 121.74 | 115.70 | રોકાશ પ્રવૃતિઓ(બી) (સી) દિશાશ પ્રવૃતિઓમાંથી | (90.21) | (94.70) | | |
| ાવલબાત વરા જ્વાબદારાઆ આવકવેરા માટેની જ્વાબદારીઓ | | | શેક્ડ પ્રવાહ : | 1 1 | | | |
| આવકવરા માટના જવાળદારાઆ પેટા કુલ– બિન વર્તમાન જવાબદારીઆ | 124.03 | 106.42 | લાંબા ગાળાના ઉધારોમાંથી ઉપજ/(પુર્નવસુલાત) | 1 1 | | | |
| | 735.13 | 736.98 | ાંબા ગાળાના ઉધારામાંથા ઉપજ/(પુનવસુલાત) ટર્મ ઉધારો | (25.70) | (10.50) | | |
| 3. વર્તમાન જવાબદારીઓ | | | કમ ઉદ્યાસ કામકાજી મુડીના ઉદ્યાસેમાં | (25.70) | (10.50) | | |
| નાણાંકિય જ્યાબદારીઓ | | 100000000000000000000000000000000000000 | લધારો/(ઘટાડો) | 11.58 | 47.15 | | |
| ઉદ્યારો | 951.67 | 940.09 | પેટાર્ડપનીઓ અને એલએલપીને (લોન)/પૂર્નવસુલાત | 11.56 | (0.00) | | |
| વેપારી સુકવવાપાત્ર | 268.96 | 313.23 | લોન પર સુકલાશેલ હશાજ | (76,16) | (70.50) | | |
| અન્ય નામાંકિય ૧પાબદારીઓ | 27.46 | 21.75 | સુકવારોલ ડિવિડન્ડ | (70.10) | (10.30) | | |
| જોગ લાઇઓ | - | | (ડિવિડન્ડ વિતરણ વેરા રાઢીત) | (10.61) | (7.08) | | |
| પેટા કુલ– વર્તમાન જવાબદારીઓ | 1,248.09 | 1,275.07 | નાણાંકિય પ્રવૃતિઓમાં વપરાયેલ યોખનો | (10.01) | (1.00) | | |
| કુલ જવાબદારીઓ | 3,560.49 | 3,546.04 | शेवड प्रवाह (सी) | (100.89) | (40.93) | | |
| | બો | ર્ડના વતી અને માટે | | (100.03) | (10.00) | | |
| | | સ્ટ્રીઝ લીમીટેક માટે | | 8.14 | 0.78 | | |
| | | | managari dan mak dan danan | 9.56 | 9.21 | | |
| | | મહર્દ આપલવાક | ainui alas and alas anuncai | 17.70 | 9.99 | | |
| સ્થળ: સિલ્લાસા, કીએનએથ | (4) | ાનેલિંગ ડાશરેક્ટર) | | | 0100 | | |